

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૧/૧૨/૨૦૧૬ ગુરૂવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી ધારા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૨૨૦/૧૬

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૪ કેસ કરી, ૧૯ વ્યક્તિઓને ઝડપી ૧૧૨ લીટર દેશી દારૂ, ૫૧ બોટલ ઈંગ્લીશ દારૂ, ૨૮૮ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ, ૧૫૨ બિયર ટીન અને ૨ સ્કૂટર કબજે કર્યા હતા. તેમજ જુગાર ધારા હેઠળ ૧ કેસ કરી ૫ વ્યક્તિઓને ઝડપી રૂપિયા ૩,૧૫૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૨૨૧/૧૬

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૮૬ વ્યક્તિઓની અને પ્રોહી.૯૩ મુજબ ૧૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૨૨૨૨/૧૬

નિકોલ: સુનીલભાઈ રામનિરજન ગીરી (રહે.સમાજ નવરચના સોસાયટી વિભાગ-૩ ખોડીયારનગર નિકોલ) એ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૩૦/૧૧/૧૬ કલાક ૧/૦૦ થી ૨/૦૦ વાગ્યા દરમિયાન પોતાના મકાનના દરવાજાની સ્ટોપર ખોલી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી એંગલમાં ભરાવેલ પેન્ટના ખિસ્સામાંથી રોકડ રૂપિયા ૯૦,૦૦૦/- ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ મ.સ.ઇ શ્રી ગણપતસિંહ બબાજી ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૨૨૨૩/૧૬

નિકોલ: ભુપેન્દ્રભાઈ છગનભાઈ ઠુમર (રહે. નિલકંઠ ફ્લેટ ખોડીયાર જ્યોત સોસાયટી નિકોલ રોડ બાપુનગર) એ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૩૦/૧૧/૧૬ સાંજના ૫/૦૦ થી ૫/૧૫ વાગ્યા દરમિયાન નિકોલ દાસ્તાન ફાર્મની સામે શ્યામવીલા રેસીડન્સીના દરવાજા આગળ પાર્ક કરેલ પોતાની કારના દરવાજાનો કાચ તોડી અજાણી વ્યક્તિ કારમાંથી ૫૦૦ ના દરની જુની ચલણી નોટ કુલ રૂપિયા ૩૭,૦૦૦/- તેમજ જરૂરી કાગળો સાથેની બ્રાઉન રંગની બેગ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી બી.સી.છત્રાલીયા ચલાવે છે.

સોનાની ચેઇન/ પર્સ ખેંચી તોડી લઇ ગયા :-

સમાચાર યાદી નં.૨૨૨૪/૧૬

સરદારનગર: સુનિતાબહેન દિલિપકુમાર રાવલાણી (રહે. રામેશ્વર આવાસ પાર્ક નોબલનગર) તા.૩૦/૧૧/૧૬ રાતના ૮/૦૦ વાગ્યાના સુમારે નોબલનગર પ્રેમપ્રકાશ આશ્રમ નજીક શાકભાજી લેવા ઉભા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ (૨૫ થી ૩૦ વર્ષના આશરાના) બે પુરુષ સુનિતાબહેનના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- ખેંચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ સુનિતાબહેન રાવલાણીએ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી પી જે ખરસાણ ચલાવે છે.

નવરંગપુરા: મોહમદ ખાલીદખાન અબ્દુલરહીમખાન મુન્સી (ઉ.વ.૫૪) (રહે. મુન્સી ટેકરા, મેનાબેન ટાવરની નજીક, ધોળકા જીલ્લો અમદાવાદ) તા.૩૦/૧૧/૧૬ બપોરના ૧૨/૧૫ વાગ્યાના સુમારે એક્સીસ બેંકમાંથી પૈસા ઉપાડી નવરંગપુરા લો-ગાર્ડન નજીકથી મોટર સાયકલ ઉપર બેસી જતા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરુષ મોહમદ ખાલીદખાન મુન્સીના ખોળામાં મુકેલ પર્સ ખેંચી ઝુંટવી લઈ નાસી ગયા હતા. જે પર્સમાં રોકડ રૂપિયા ૧૦,૬૦૦/- અને જરૂરી દસ્તાવેજ હતા. આ અંગેની ફરીયાદ મોહમદ ખાલીદખાન મુન્સીએ નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી બી.કે ગોસ્વામી ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૨૨૨૫/૧૬

મેઘાણીનગર: આશારામ રામપ્રકાશ પ્રજાપતિ (ઉ.વ.૩૩) (રહે.સંતોકબેનની ચાલી ચમનપુરા મેઘાણીનગર) એ અગમ્ય કારણસર તા.૩૦/૧૧/૧૬ કલાક ૯/૧૦ વાગ્યા પહેલા પોતાના ઘરે લોખંડની ઓંગલ સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે મેઘાણીનગર પોલીસે અકસ્માત નોંધ નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી દિલીપસિંહ ગંભીરસિંહ ચલાવે છે.

ઓઢવ: તા.૩૦/૧૧/૧૬ કલાક ૪/૧૫ વાગ્યાના સુમારે ઓઢવ પોલીસને ઓઢવ તેજેન્દ્ર કોમ્પ્લેક્ષ દુકાન નંબર બી/૩૧ ની આગળ આવેલ કુટપાથ પાસે ગુલમહોરના ઝાડ નીચે ગળેફાંસો ખાધેલ હાલતમાં ૨૯ વર્ષના આશરાનો અજાણ્યો પુરુષ મળી આવતા ઓઢવ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી રાવજીભાઈ ભીમાજી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.